

647510**MA02EcoE0412****Seat No: _____****M.A. (ECONOMICS) Semester - 2(CBCS) Examination****March/April- 2018****THEORIES OF ECONOMIC DEVELOPMENT
(INTERDISCIPLINARY/ELECTIVE)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ વસ્તી અને આર્થિક વિકાસ વચ્ચેનો સંબંધ સમજાવો. ભારતનાં આર્થિક વિકાસ પર વસ્તી વૃદ્ધિની અસરોની ચર્ચા કરો. (૧૪)

અથવા

પ્રશ્ન-૧ આર્થિક વિકાસનો અર્થ આપી આર્થિક વિકાસને અસર કરનારા પરિબલોની સવિસ્તાર ચર્ચા કરો.

પ્રશ્ન-૨ આર્થિક વિકાસ અંગે શક્તિશાળી પ્રયાસનો (Big Push) સિદ્ધાંત સમજાવો. (૧૪)

અથવા

પ્રશ્ન-૨ સમતુલિત અને અસમતુલિત આર્થિક વિકાસનાં અભિગમની સવિસ્તાર ચર્ચા કરો.

પ્રશ્ન-૩ આર્થિક વિકાસમાં રાજકોષીય અને નાણાંકીય નીતિની ભૂમિકા ચર્ચો. (૧૪)

અથવા

પ્રશ્ન-૩ આર્થિક વિકાસમાં કૃષિ અને ઉદ્યોગોનું મહત્વ સમજાવો.

પ્રશ્ન-૪ આર્થિક વિકાસની પ્રક્રિયામાં શુમ્પીટરનાં 'નવ પ્રવર્તન' અને 'નિયોજક' ની ભૂમિકાની સમીક્ષા કરો. (૧૪)

અથવા

પ્રશ્ન-૪ આર્થિક વિકાસ અંગેનો રિકાર્ડોનો સિદ્ધાંત સમજાવો. (૧૪)

પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો. (ગમે તે બે) (૧૪)

(૧) ભારતમાં ગરીબીનાં નિર્દેશકો.

(૨) આર્થિક વિકાસ અંગેનો એકમ સ્મિથનો સિદ્ધાંત.

(૩) આર્થિક વિકાસ અંગેનો અમર્ત્ય સેનનો અભિગમ. (૪) કાર્લમાર્ક્સનો અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત.

English Version

Que-1 Explain the relation between population and economic development and discuss the impacts of population growth on Indian economic development. (14)

OR

Que-1 Give meaning of Economic development and discuss in detail factors affecting economic development.

Que-2 Explain the 'Big Push' theory of economic development. (14)

OR

Que-2 Discuss in detail the balanced and unbalanced approaches of economic development.

Que-3 Discuss the Role of fiscal and monetary policy in economic development. (14)

OR

Que-3 Explain the importance of agriculture and industry in economic development.

Que-4 Review the role of 'Innovation' and 'Entrepreneur' in the process of Economic development as explained by Schumpeter. (14)

OR

Que-4 Explain theory of economic development given by Ricardo.

Que-5 Write short notes. (any two) (14)

(1) Indicators of poverty in India.

(2) Theory of economic development given by Adam Smith.

(3) Amartya Sen's approach to Economic development.

(4) Theory of Surplus value of Karl Marx.
